

શુક્રજીનું સમયપત્રક - નિયો ઇક્વિટસ સેવિંગ્સ એક્ઝાઉટટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)

| નિયો ઇક્વિટસ ક્રૂપ ક્રેડિટ એક્ઝાઉટટ | |
|---|---|
| સરેરાશ માસિક લેટેજન્સ (AMB) | (બોકોમેન્ટ / લિન્ડિન્ફો ક્રેડિટ) |
| સરેરાશ માસિક લેટેજન્સ | શુલ્ષુ |
| AMB લિન-જાળવણી શુલ્ક | લાનું પદ્ધતું જાણી |
| દેખાતી એક્ઝાઉટટ અથવા નિયોજને એક્ઝાઉટટ સાથે શુલ્પિંગ | |
| ક્રેડિટ એક્ઝાઉટટ શુલ્પિંગ | સમાન અથવા ઉર્દુ મુખ્યાના ક્રેડિટ એક્ઝાઉટટનાં શુલ્પ ક્રીડ શક્ય છે |
| સેવિંગ્સ એક્ઝાઉટટ શુલ્પિંગ | ઉર્દુ મુખ્યાના સેવિંગ્સ એક્ઝાઉટટનાં શુલ્પ ક્રીડ શક્ય છે |
| ચેક લુક (રપ ટીકનો PAP ચેક લુક) મખીઓ | વિનાતી પર દંતા માટેની ચેક લુકમણ્ઠ (જો લેંકમાં અપદેંક્યામાં આવી હોય તો જુદુ) |
| મફત મર્યાદાથી વધુ પર શુલ્ક | પ્રતિ લીટક ૨ રૂપીયા |
| ઉદ્ઘરાણી | |
| રથાનિક એક્ઝિટિવ એક્સ્પ્રેસ | મફત |
| લેંક ખાતો અન્ય લેંકમાં ચેક ક્રેડિટ લાનું શુલ્ક | કૃ. ૫૦૦૦ સુધીનું શુલ્ક કૃ. ૨૫, કૃ. ૫૦૦૦ થી વધુ અને કૃ. ૧૦,૦૦૦ સુધીનું શુલ્ક કૃ. ૫૦/-, કૃ. ૧૦,૦૦૦ થી વધુ અને કૃ. ૧૦૦૦૦૦ સુધીનું શુલ્ક કૃ. ૧૦૦/-, કૃ. ૧૦૦૦૦૦ થી વધુનું શુલ્ક કૃ. ૧૫૦/- |
| RTGS ધરાવક / NEFT ધરાવક / IMPS ધરાવક | મફત |
| ક્રોન ઇન્સિન્કરેશન લેટેજન્સ | મફત |
| ચુક્કવણી | |
| શાખામે ટિમાનાડ ક્રુદ અને પેન્ફોડ (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | દર માટેની ચુક્કી સુધી મફત (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) |
| મફત મર્યાદા પછી શુલ્ક (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | પ્રતિ ચીરી કૃ. ૫૦ |
| શાખા સિવાયાના સ્થળોને ટિમાનાડ ક્રુદ (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | પ્રતિ ચીરી કૃ. ૧૦૦ |
| PAP ચેક વડે ચુક્કવણી | મફત |
| શાખામાં RTGS અને NEFT એક્ઝાઉટટ (મફત ડોલરાઈન) (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | NEFT: કૃ. ૧૦૦૦૦/- સુધી કૃ. ૨૫, કૃ. ૧૦૦૦૧ થી કૃ. ૧૦૦૦૦ સુધી: કૃ. ૪૫, કૃ. ૧૦૦૦૦૦ થી કૃ. ૨૦૦૦૦૦ સુધી: કૃ. ૧૫, કૃ. ૨૦૦૦૦૦ થી કૃ. ૩૦, કૃ. ૨૦૦૦૦૦ થી કૃ. ૫૦૦૦૦૦ સુધી: કૃ. ૨૦, કૃ. ૫૦૦૦૦૦૦ થી વધુ: કૃ. ૪૦. |
| IMPS એક્ઝાઉટટ (ટિપસ લીટમર્યાદા કૃ. ૫,૦૦,૦૦૦/-) | ૫૦૦૦૦ રૂપિયા સુધી: કૃ. ૨૫/-, કૃ. ૫૦૦૦૦૦- કૃ. ૧૫ લાખ: કૃ. ૫/-, - કૃ. ૧ લાખથી વધુ: કૃ. ૭૫/- |
| રોક્ક શુલ્ક | |
| રેન્ફલ રેથાને રોક્ક જાણા (એકેન્નમ અને શાખા સહિત) | પ્રતિ માટેની ચુક્કી સુધી મફત. |
| બિન-રેન્ફલ રેથાને રોક્ક જાણા (એકેન્નમ અને શાખા સહિત) | ક્રેડિટ મફત મર્યાદા જાણી |
| મફત મર્યાદાથી વધુ પર શુલ્ક (હેઠળ શાખા અને બિન-હેઠળ શાખા) | કૃ. ૫/૧૦૦ |
| રેન્ફલ રેથાને રોક્ક ઉપાડ (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | મફત |
| બિન-રેન્ફલ રેથાને રોક્ક ઉપાડ (જો લેંકમાં સહી અપદેંક્યામાં આવી હોય તો જુદુ) | કૃ. ૩/૧૦૦ |
| ઇક્વિટસ લેંકમાં એટીએમ પર ટેલેટ ક્રુડ વડે ચુક્કવણો (નાણાકીય અને બિન-નાણાકીય વચ્ચાનો સહીત) | મફત અમચ્યારીટા |
| મેન્ડો રેથાને અન્ય લેંકમાં એટીએમ પર ટેલેટ ક્રુડ વડે ચુક્કવણો (નાણાકીય અને બિન-નાણાકીય વચ્ચાનો સહીત) | ૩ વચ્ચાનો |
| નોન-મેન્ડો રેથાને અન્ય લેંક એટીએમ પર ટેલેટ ક્રુડ વડે ચુક્કવણો (નાણાકીય વચ્ચાનો સહીત) | ૫ વચ્ચાનો |
| નોન-ઇક્વિટસ એટીએમનો ઉપરોક્તા - અપ્સ્ટ્રો ભંડાળે કરતી રોક્ક ઉપાડનકાર્યો | કૃ. ૧૦ પ્રતિ વચ્ચાનો |
| મુક્કા મર્યાદાથી વધુના નાણાકીય વચ્ચાનો પર શુલ્ક* | કૃ. ૨૩ પ્રતિ વચ્ચાનો |
| મુક્કા મર્યાદાથી વધુના બિન-નાણાકીય વચ્ચાનો પર શુલ્ક | કૃ. ૧૨ પ્રતિ વચ્ચાનો |
| ભારતીના લાનર રોક્ક ઉપાડ (માત્ર અનોન્ટરાન્યુય ક્રુડ માટે) | કૃ. ૫૮૮ પ્રતિ વચ્ચાનો (લાનું જ સહિત) |
| ભારતીના લાનર લેટેજન્સ પ્રોફ્રેચર (માત્ર અનોન્ટરાન્યુય ક્રુડ માટે) | કૃ. ૨૫/- પ્રતિ વચ્ચાનો |
| અન્ય શુલ્ક | |
| વિના વર્ચ્યુઅલ ક્રેન્ટક (ક્રેડિટ ઇક્વિટસ વચ્ચાનો માટે) | લાનું પદ્ધતું જાણી |
| વિના પ્રેસિન્મ ટેન્નેજ ક્રુડ (જારી કરા પર તારીખ ૧ ઓગસ્ટ, ૨૦૨૨ થી અમલમાં) અને ફીની જારી કરા પર શુલ્ક (તારીખ ૮ જુનાનાથી ૨૦૨૩ થી અમલમાં) | કૃ. ૨૫૦ |
| ટેન્નેજ એક્ઝાઉટટ ક્રુડ (ક્રેડિટ ઇક્વિટસ વચ્ચાનો શુલ્ક) | કૃ. ૨૫૦ - પ્રતિ સ્થિર |
| ટેન્નેજ પ્રેસિન્મ ટેન્નેજ એક્ઝ (અનોન્ટરાન્યુય મફત) | કૃ. ૧૦૦ પ્રતિ એક્ઝ |
| ટેન્નેજ પ્રેસિન્મ ટેન્નેજ (અનોન્ટરાન્યુય મફત) | ૨૫ એક્ઝની ક્રીડ માટે કૃ. ૧૫૦ |
| નાણાકીય ક્રેન્ટોસેન ઇન્વાવક એક્ઝિટન્સ શુલ્ક | ૨ એક્ઝની ક્રીડ માટે કૃ. ૫૦૦ થી, ક્રીડ એક્ઝ કૃ. ૭૫૦/- થી |
| નાણાકીય ક્રેન્ટોસેન આઉટક્રુડ એક્ઝિટન્સ શુલ્ક | કૃ. ૭૫ પ્રતિ એક્ઝ |
| રથાની સુધુનાનો સેટઅપ/સુધુરાણ (RD/SIP/લિલ ચુક્કવણીઓ માટેમફત) | પ્રતિ વાખત કૃ. ૨૫/- |
| રથાની સુધુનાનો લિલાન્ન (વીની) | પ્રતિ રિલેન્સ કૃ. ૧૫૦/- |
| નાણાકીય ક્રેન્ટોસેન એક્ઝિટન્સ વિના | પ્રતિ વાખત કૃ. ૨૦૦/- |
| SMS વેચાવણીઓ (ક્રેન્ટ અને ક્રેડિટ વચ્ચાનો) | પ્રતિ માટેની ૧૦ મફત SMS, ત્યાનાનાં, પ્રતિ SMS ૩૦ પૈસા |
| શૈરેન એક્સપ્રેસમેન્ટ માટ્ક-અપ | કૃ.૫% |

શુક્રજીનું સમયપત્રક - નિયો ઇક્વિટાસ સેવિંગ્સ એક્ઝાઉન્ટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)

| નિયો ઇક્વિટાસ કૂલ કેવાથાસી એક્ઝાઉન્ટ (બાળોને / વિભિન્ન કોન્સેન્સી) | |
|---|---|
| પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કર્યું | |
| પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું રેટએન્ટ (ઓળાઇન મફત) | ૧ વર્ષ મફત, વ્યાખ્યાન પ્રતી રેટેન્ટ ૩, ૩૦૦ |
| પાસલુક જારી કર્યું | મફત (વિનંતી પર ઉપલબ્ધ) |
| કુલિનેક્ટ પાસલુક જારી કર્યું | રૂ. ૫૦ |
| સરળની ચક્રવારી પ્રમાણપત્ર/શૈખ પ્રમાણપત્ર/સરળમાની પુરુષ (જો બેન્કમાં સહી અપદેશ ક્રયામાં આવી હોય તો જે) | પ્રતી વર્ષ રૂ. ૫૦/- |
| કુલિનેક્ટ TDS પ્રમાણપત્ર | રૂ. ૧૦૦ |
| કુલિનેક્ટ એક્સાઉન્ટ રેટેન્ટ (મફત ઓળાઇન અથવા ઇમેલ પર) | રૂ. ૨૦૦ |
| DDPO પ્રલાભનીકાળ/ર્વીકાળ (મફત ઓળાઇન અથવા ઇમેલ પર) (જો બેન્કમાં સહી અપદેશ ક્રયામાં આવી હોય તો જે) | રૂ. ૧૦૦ |
| *ખાતું ખોલ્યાના ૧૫ ટિયસ પણ અને ૫ મહિના પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની વિનંતી પર ખાતું બંધ | રૂ. ૨૫૦ |
| ખાતું નિર્ધિષ્ટ રેટેન્ટ પર શુક્ર | શુક્ર |
| શાખામાં બેલેન્સ પ્રમાણપત્ર (ઓળાઇન મફત) | રૂ. ૨૫૦ |
| ઓર્ટરટૈપ લોક્સ્* એક્સિઝન્પ (ક્રેલ પર) | પ્રતી વર્ષ રૂ. ૫૦/- |
| એક્સિઝન્પ લીટ (૨ મહિને શુક્ર) | રૂ. ૩૦૦ |
| ક્રેલ પિકાન્પ લીટ (૨ મહિને શુક્ર) | રૂ. ૩૪૦૦ |
| રૂ. ૨૦૦૦૦૦ સુધી | રૂ. ૩૪૦૦ |
| ૨૦૦૦૦૦ થી ૫૦૦૦૦૦ | રૂ. ૩૫૦૦ |
| ૩. ૫૦૦૦૦૦ થી ૩. ૧૦૦૦૦૦ | રૂ. ૩૦૦૦૦ |
| ૧૦૦૦૦૦ થી વધુ | શાખાની સંપર્ક જો |
| ક્રેલ પર ક્રેલ પિકાન્પ (ટ્રેક વાળે શુક્ર) | |
| રૂ. ૨,૦૦,૦૦૦ સુધી | રૂ. ૧૫૦ |
| ૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ | રૂ. ૩૦૦ |
| ૩. ૫,૦૦,૦૦૦ થી ૩. ૧૦,૦૦,૦૦૦ | રૂ. ૪૫૦ |
| ૩. ૧૦,૦૦,૦૦૦ થી ૩. ૨,૦૦,૦૦૦ | રૂ. ૮૦૦ |
| ૩. ૨,૦૦,૦૦૦ થી વધુ | શાખાની સંપર્ક જો |
| બ્યાંકનોની સંપર્ક | |
| ગ્રાહક ક્રયામાં આવેલા તમામ બ્યાંકનોનું એક્સ્ચેન્જ જેમાં શામેલ કે: | |
| રોક્ક/એક્સ/RTGS/NEFT/DSB/DD (ઓળાઇન અને એટીએમ પદ્ધતેના બ્યાંકના સિવાય) | ૮૮ મહિને રૂ બ્યાંકને સુધી મફત |
| મુફત મધ્યદીઘે વધુ પર શુક્ર | વ્યક્તિગત બ્યાંક મધ્યદી ઉપરોક્ત પ્રતી બ્યાંકર ૩. ૧૫ |

*ગ્રાહકી વિનંતી પર અને બિયમનકારી ક્રરણોસર લેંકડ્રાગ બંધ કર્યા પર ખાતું નંબ કર્યાના શુક્ર વાતું

લાનું પડતા રૂ બધારાના રેણ્ટો

*નાણાકીય બ્યાંક તરફે જણાવામાં આવતા અપ્રાતા ભક્તિજીને ક્રાંતિક રોક્ક ઉપાડ નિઝલ

^૧ભારતીય ચલાયાના, આતોરાજીય ચલાયાના પર અથવા ભારતામાં કાર્યક્રમ વંતું નિર્ધિષ્ટ રાજ્યાં નોનાની રેપારીઓ માટે ભારતીય ચલાયાના ક્રયામાં આવતા ટ્રેક આતોરાજીય બ્યાંકર પર ૩. ૫૮% શ્રોદેક્ષ માર્ક-અપ હી (લાનું પડતા રૂ) વસ્તુવાના આવશી. આ ઇન્જિન ખાતા હેઠળ આશી કર્યાના તમામ ડેવિટ ક્રાંતિક માટે ટાનું પડે છે, સિવાય કેન્દ્રાની (માર્ટલ્યાન્ડ-વર્ક્સ) અને જાપ્યા (વિકા પોલિયા) ક્રાંતિક નોંધ લો કે મેંકી વિરેક્ટુનિયા આધારે આ સમયાંને નદ્દીદાર રૂંકે.